

July 27, 2020

BSE Limited Listing Department Phiroze Jeejeebhoy Towers Dalal Street Mumbai 400 001 National Stock Exchange of India Limited Listing Department Exchange Plaza, 5th floor Plot No. C/1, G Block Bandra-Kurla Complex Bandra (East) Mumbai 400 051

Dear Sir/Madam,

#### **Extract of Financial Results - Newspaper Publication**

Pursuant to Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we forward herewith a copy of the extract of unaudited financial results (Standalone and Consolidated) for the quarter ended June 30, 2020 published in Financial Express (all editions) and Vadodara Samachar.

You are requested to please take the above on record.

Yours faithfully,
For ICICI Bank Limited

Vivek Ranjan Chief Manager

Vadodara 390007. India

Date: July 26, 2020

Total Income from operations (net)

Exceptional items

Notes:

Paid-up equity share capital

(Face value Rs.10/- per share)

held on July 25, 2020.

(www.zenotechlab.com).

Place: Hyderabad

Date: July 25, 2020

Net Profit/(Loss) before exceptional items and tax

Net Profit/(Loss) after exceptional items and tax

Audited Balance Sheet of the Previous Year

Earnings/ (loss) per share (Basic & Diluted)

Place: New Delhi

# RELIGARE RELIGARE ENTERPRISES LIMITED

CIN: L74899DL1984PLC146935

Regd. Office: 1st Floor, P-14, 45/90, P- Block, Connaught Place, New Delhi -110001 Phone: +91-11 - 4002 1400 | Fax No. : +91-11- 4002 1401 Website: www.religare.com | email: Investorservices@religare.com

#### RESULT OF POSTAL BALLOT

Pursuant to the Postal Ballot Notice dated June 17, 2020, Section(s) 108 and 110 of the Companies Act, 2013 read with rules made thereunder & Secretarial Standard - II issued by the Institute of Company Secretaries of India on General Meetings and in terms of the General Circular No.14/2020 dated 8th April 2020 and General Circular No.17/2020 dated 13th April 2020 read with General Circular No. 22/2020 dated 15th June 2020 issued by the Ministry of Corporate Affairs (the "MCA Circulars") and on basis of report of the scrutinizer, the result of the Postal Ballot (via e-voting) was announced and submitted to the stock exchanges on Friday, July 24, 2020. Summary of Postal Ballot results is as follows:

Particular(s)	Ordinary Resolution for Re-classification of Promoters and Promoters Group into Public Shareholders Category					
	Postal Ballot	e-Votes	%age			
Assent	NA	11,82,81,993	99.47			
Dissent	NA	6,25,533	0.53			
Total	NA	11,89,07,526	100.00			

Accordingly, the Resolution as set out in the Notice of Postal Ballot dated June 17, 2020 were approved by the members with requisite majority and deemed to have been passed on Thursday, July 23, 2020 being the last date specified for the e-voting in terms of Secretarial Standards on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India.

**PARTICULARS** 

Total Comprehensive income for the period (comprising profit/(loss)

for the period after tax and other comprehensive income after tax)

Reserves (excluding Revaluation Reserve) as shown in the

By Order of the Board of Directors For Religare Enterprises Limited

CIN: L27100TG1989PLC010122

Survey No. 250-252, Turkapally (V), Shameerpet (M), Hyderabad - 500078

Phone:+91 90320 44584/585/586 Website: www.zenotechlab.com

**EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS** 

FOR THE QUARTER ENDED 30 JUNE 2020

1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting

2. The financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS)

3. The figures of the last quarter are the balancing figures between audited figures in respect of the full financial year upto

4. The above is an extract of the detailed format of unaudited financial results filed with the Stock Exchange under Regulation

Standards) (Amendment) Rules, 2016. The Company adopted Ind AS from April 1, 2016.

the third guarter of the financial year which were subject to limited review.

notified under the Companies (Accounting Standards) Rules, 2015 as amended by the Companies (Indian Accounting

March 31, 2020 and the unaudited published year-to-date figures upto December 31, 2019, being the date of the end of

33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited

financial results is available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company's website

Reena Jayara **Company Secretary** 

Unaudited

502.51

(39.45)

(39.45)

(40.62)

6,103.06

(0.06)

MAAN

Regd. Office: 4/5, I" Floor, Asaf Ali Road, New Delhi-110002 CIN No.: L30007DL2003PLC214485 Website: www.maanaluminium.com Email: secretarial@maanaluminium.in Ph: 40081800

Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015 with the Stock Exchange(s), Notice is hereby given that the Meeting of Board of Directors is scheduled to be held on Friday, 31st July, 2020 at 4/5, 1st Floor Asaf Ali Road, New Delhi- 110002 at 12.30 P.M. inter-alia to consider, approve and take on record the Audited Financial Results for the guarter and year ended March 31, 2020 and Un-Audited Financial Results for the First Quarter ended June

This is also to inform you that as per Code of Conduct of the Company for Prevention of Insider Trading in the securities of the Company, the Trading Window shall remain closed for all the Directors/ Officers/ Designated Employees / specified persons of the company from April 1 2020 and shall remain closed till 48 hours after the announcement of the results

of the Company i.e. www.maanaluminium.in as well as website of the Stock Exchanges i.e. BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Ltd (www.nseindia.com)

Place: New Delhi Date: 26.07.2020

(Rs. in lakhs, except share and per equity share data)

Unaudited

725.97

185.66

185.66

185.85

6,103.06

By order of the Board

for **Zenotech Laboratories Limited** 

Sd/-

Dr. Azadar Hussain Khan

Chairman

DIN: 01219312

0.30

**Quarter Ended** 

Audited\*

554.41

(3.39)

(3.39)

(8.65)

6,103.06

(0.01)

30.06.2020 | 31.03.2020 | 30.06.2019 | 31.03.2020

0 McLEOD RUSSEL

Believe in tea McLEOD RUSSEL INDIA LIMITED

Corporate Identity Number (CIN): L51109WB1998PLC087076 Regd. Office: Four Mangoe Lane, Surendra Mohan Ghosh Sarani, Kolkata-700 001 Telephone: 033-2210-1221. Fax: 91-33-2248-8114/6265 Website: www.mcleodrussel.com. E-mail: investors@mcleodrussel.com

NOTICE OF BOARD MEETING

NOTICE is hereby given pursuant to Regulation 47 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 that a Meeting of the Board of Directors of McLeod Russel India Limited ('the Company') will be held on Thursday, 30th July, 2020 at the Registered Office of the Company inter alia to consider and approve the Audited Financial Results of the Company for the Quarter and Year ended 31st March, 2020.

This Notice will also be made available on the websites of the stock exchanges, www.bseindia.com, www.nseindia.com and www.cse-india.com as also on the website of the Company, www.mcleodrussel.com

> McLEOD RUSSEL INDIA LIMITED ALOK KUMAR SAMANT

COMPANY SECRETARY

Date : 25th July, 2020

Place : Kolkata

# **UFO Moviez India Limited**

CIN: L22120MH2004PLC285453.

Regd. and Corporate Office: Valuable Techno Park, Plot #53/1, Road #7 MIDC, Marol, Andheri (E), Mumbai - 400093 Tel: +91 22 40305060 Fax: +91 22 40305110 Email: investors@ufomoviez.com / Website: www.ufomoviez.com;

NOTICE OF THE 16TH ANNUAL GENERAL MEETING OF UFO MOVIEZ INDIA LIMITED TO BE HELD THROUGH VIDEO CONFERENCE (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM

NOTICE is hereby given that the 16th Annual General Meeting ("AGM") of the members of UFO Moviez India Limited ("the Company") will be held on Thursday, August 20, 2020 at 03.00 PM IST, through Video Conference (VC) / Other Audio Visua Means (OAVM) without the physical presence of the Members at a common venue, in compliance with General Circular No. 14/2020 dated April 8, 2020, No. 17/2020 dated April 13, 2020, No. 20/2020 dated May 5, 2020 issued by Ministry of Corporate Affairs ("MCA Circulars") and other applicable provisions of the Companies Act, 2013 and circular issued by the Securities and Exchange Board of India dated May 12, 2020 ("SEBI Circular") to transact the business as set out in the Notice convening the 16th AGM.

In compliance with the said MCA circulars and SEBI circular, electronic copies of the Notice of the 16th AGM, procedure and instructions for e-voting and the Annual Report for 2019-20 will be sent to those Members whose email IDs are registered with the Company/Depositories.

Members who have not registered their e-mail address are requested to register the same in respect of the shares held in electronic form with the Depository through their Depository Participant(s) and in respect of shares held in physical form by writing to the Registrar and Transfer Agent (RTA), KFin Technologies Private Limited, Selenium Tower B. Plot 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad – 500

The Company has enabled the Members to temporarily update their email address by accessing the link https://ris.kfintech.com/email\_registration/, for the limited purpose of receiving the Annual Report 2019-20 and the Notice of the 16th AGM (including evoting instructions) electronically.

The Notice of the 16th AGM and the Annual Report will be made available on the website of the Company at https://www.ufomoviez.com/investor, on the website of the RTA at https://evoting.karvy.com/ and on the websites of BSE Limited at https://www.bseindia.com / and National Stock Exchange of India Limited a https://www.nseindia.com/

(Management and Administration) Rules, 2014 ("the Rules") and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (\*Listing Regulations"), that the Register of Members and Transfer Books of the Company shall remain closed from Friday, August 14, 2020 to Thursday, August 20, 2020 (both days inclusive) for the purpose of the AGM.

electronic means both through remote e-voting and e-voting at the AGM. Detailed procedure for joining the AGM and remote e-voting/e-voting is provided in the Notice of 16th AGM. Members attending the AGM through VC/OAVM will be counted for th purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

Date : July 25, 2020 Place: Mumbai

Sameer Chavan Company Secretary (FCS-7211)

# MOLD-TEK

Date: 25.07.2020

Place: Hyderabad

#### MOLD-TEK PACKAGING LIMITED CIN: L21022TG1997PLC026542

Regd. Off: 8-2-293/82/A/700, Ground Floor, Road No 36, Jubilee Hills, Hyderabad-

500033, Telangana, India. Ph No: 040-40300300, Fax No:040-40300328 Email:cs@moldtekpackaging.com, Website: www.moldtekgroup.com

Notice is hereby given pursuant to Regulation 47 read with Regulation 29 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a meeting of the Board of Directors of the Company will be held on Saturday, 1st August, 2020 at the registered office of the company situated at Plot No.700, Ground Floor, Jubilee Hills, Road No.36, Hyderabad -500033, Telangana, India, inter-alia, to consider approve and take on record the un-audited Financial Results - Consolidated and Standalone of the Company for the guarter ended on 30th June, 2020 for the financial year 2020-2021. The information contained in this notice is also available on the Company's website at

www.moldtekgroup.com and the website of Stock Exchanges where the Company's shares are listed i.e. BSE Limited (www.bseindia.com) and the National Stock Exchange of India Limited (www.nseindia.com). For Mold-Tek Packaging Limited

Thakur Vishal Singh

(Company Secretary)

**DYNACONS SYSTEMS & SOLUTIONS LIMITED** 

Regd. Office: 78, Ratnajyot Industrial Estate, Irla Lane, Vile Parle (W), Mumbai – 400056. CIN No: L72200MH1995PLC093130 Web site: www.dynacons.com

NOTICE Pursuant to Regulation 29 read with Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosures Requirements) Regulations, 2015, Notice is hereby given that a meeting of the Board of Directors of the Company will be held on Friday, July 31, 2020 at the Registered office of the Company, inter- alia to consider and take on record the Audited Financial Results (Standalone & Consolidated) for the guarter and financial year ended March 31, 2020 and to recommend a final dividend, if any, on the equity shares of the Company for the financial year ended March 31, 2020 subject to the approval of

The Company shall intimate to the exchanges the Audited Financial Results upon the conclusion of the aforesaid Board Meeting and will arrange for the announcement of the same in the press and on the Company's website as required under Listing Regulations. By order of the Board of Directors For Dynacons Systems & Solutions Limited

the shareholders at the ensuing 25th Annual General Meeting of the Company.

Place: Mumbai Date: 24th July, 2020

Shirish M. Anjaria Chairman cum Managing Director DIN: 00444104

REGENCY INVESTMENTS LIMITED

CIN: L67120PB1993PLC013169

Regd Office: Unit No. 49 B, 3rd Floor,

Sushma Infinium, Chandigarh Ambala

Highway Zirakpur 140603 PB IN

Email ID: regencyinvestmentsltd@gmail.com

PUBLIC NOTICE

In compliance with the Para 5 of Notification

No. DNBR.(PD) 029/CGM(CDS)-2015 dated

July 09, 2015 issued by Reserve Bank of

India on July 09, 2015. Notice is hereby given

that the Regency Investments Limted, a company incorporated under the companies

Act, 1956 and Registered with Reserve Bank

of India vide Certificate Number 06.00100 as

a Non Deposit taking Non-Banking Finance

Company, with its Registered office situated

at Unit No. 49 B, 3rd Floor, Sushma Infinium,

Chandigarh Ambala Highway Zirakpur

140603 PB IN is intended to appoint Mr Vishal

Rai Sarin S/o Sh Kuljas Rai Sarin R/o House

WILLIAMSON MAGOR & CO. LIMITED Corporate Identity Number (CIN): L01132WB1949PLC017715 Regd. Office: Four Mangoe Lane, Surendra Mohan Ghosh Sarani,

Kolkata-700 001 Telephone: 033-2210-1221 Fax: 91-33-2248-8114/6265 Website: www.wmtea.com

E-mail: administrator@mcleodrussel.com NOTICE OF BOARD MEETING

NOTICE is hereby given pursuant to Regulation 47 (1) (a) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that a Meeting of the Board of Directors of Williamson Magor & Co. Ltd. ('the Company') will be held on Tuesday, 28th July, 2020 at the Registered Office of the Company inter alia to consider and approve the Audited Financial Results of the Company for the Quarter and year ended 31st March, 2020.

This Notice will also be made available on the websites of the Stock Exchanges, www.bseindia.com. www.nseindia.com and www.cseindia.com as also on the website of the Company, www.wmtea.com.

WILLIAMSON MAGOR & CO. LIMITED **ADITI DAGA** COMPANY SECRETARY Place: Kolkata

Date: 25.07.2020

no 155, Kamla Devi Avenue Fathegarh Churian Road, Amritsar, Punjab as Additional Director. The above Notice is being given pursuant to RBI Circular DNBR, (PD) CC, No.065/ 03.10.001/2015-16 dated July, 09, 2015 and other relevant Regulations. The company has

already obtained the prior approval for said appointment from RBI, Chandigarh vide letter No. चंडी.प.वि. (एन.वी.एफ.सी) सं./65/16.31.149/ Any clarification / Objection in this regard may be addressed to Department of Non-Banking Supervision, Reserve Bank of

India, Sector 17, Chandigarh 160017 within 30 days from the date of publication of this notice stating therein the nature of interest and grounds of objection.

For Regency Investments Limited

Place: Zirakpur

Managing Director Date: 25.07.2020 DIN: 06717452

Gaurav Kumar

PUBLIC NOTICE ICICI Bank ICICI Bank Limited

CIN-L65190GJ1994PLC021012 Registered Office: ICICI Bank Tower, Near Chakli Circle, Old Padra Road, Vadodara - 390 007. Corporate Office: ICICI Bank Towers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051. Phone: 022-26538900, Fax: 022-26531230, Email: investor@icicibank.com Website: www.icicibank.com

FINANCIAL RESULTS

(₹ in crore)

		STANDALONE			CONSOLIDATED			
Sr. no.		Three months ended		Year ended	Three months ended		Year ended	
	Particulars	June 30, 2020 (Q1-2021)	June 30, 2019 (Q1-2020)	March 31, 2020 (FY2020)	June 30, 2020 (Q1-2021)	June 30, 2019 (Q1-2020)	March 31, 2020 (FY2020)	
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1.	Total income from operations (net)	26,066.95	21,405.50	91,246.94	37,939.32	33,868.89	149,786.10	
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3,182.50	2,792.73	14,048.04	4,587.30	4,208.35	18,588.61	
3.	Exceptional items		344					
4.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	3,182.50	2,792.73	14,048.04	4,587.30	4,208.35	18,588.61	
5.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) (refer note no. 2)	2,599.15	1,908.03	7,930.81	3,117.68	2,513.69	9,566.31	
6.	Total comprehensive income for the period [Comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	N.A.	N.A.	N.A.	N.A.	N.A.	N.A	
7.	Paid-up equity share capital (face value ₹ 2 each)	1,295.41	1,290.73	1,294.76	1,295.41	1,290.73	A COSTO HIS SOURCE ATTO	
8.	Reserves excluding revaluation reserves	114,205.75	106,059.73	112,091.29	121,705.39	112,386.99	118,518.45	
9.	Earnings per share (EPS):							
	Basic EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹)	4.01	2.96	12.28	4.82	3.90	14.81	
	Diluted EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹)	3.98	2.91	12.08	4.76	3.83	14.55	

1. Since the first quarter of CY2020, the Covid-19 pandemic has impacted most of the countries, including India. This resulted in countries announcing lockdown and quarantine measures that sharply stalled economic activity. The Government of India initiated a nation-wide lockdown from March 25, 2020 which was further extended until May 31, 2020. A gradual and calibrated easing of lockdown measures has started from June 2020.

The lock-down measures have significantly impacted economic activities in Q1-2021. Current estimates of growth in India's gross domestic product by various agencies and analysts indicate a contraction in the economy in fiscal 2021. During Q1-2021, the loan growth was impacted due to lower credit demand and fee income declined due to lower borrowing and investment activity by customers and lower consumer spends. The slowdown in the economy is expected to result in higher additions to non-performing loans, increase in provisions, lower loan growth and fee income. With an intention to mitigate the burden of debt servicing brought about by disruptions on account of Covid-19 pandemic and to ensure the continuity of viable businesses, RBI through its

circular dated March 27, 2020 permitted banks to grant a moratorium to their customers on the payment of instalments and/or interest, falling due between March 1, 2020 and May 31, 2020. This period was extended by RBI till August 31, 2020 through its circular dated May 23, 2020. The Bank has accordingly extended the moratorium option to its borrowers in accordance with its Board approved policies. The impact of Covid-19 pandemic on the Bank is highly uncertain and will depend on the ongoing spread of Covid-19, the effectiveness of current and future steps taken by governments and central banks to mitigate the economic impact, steps taken by the Bank and the time it takes for economic activities to return to pre-pandemic levels. The Bank's capital and liquidity position

is strong and would continue to be the focus area for the Bank during this period. During Q1-2021, the Bank has made an additional Covid-19 related provision amounting to ₹5,550.00 crore. At June 30, 2020, the Bank held Covid-19 related provision of ₹8,275.00 crore.

This additional provision made by the Bank is more than requirement as per the RBI guideline dated April 17, 2020. 2. During Q1-2021, the Bank sold equity shares representing 3.96% in ICICI Lombard General Insurance Company Limited and 1.50% in ICICI Prudential Life Insurance Company Limited for

financial results for Q1-2021 The Indian Accounting Standards (Ind AS) are currently not applicable to banks in India. Note: The above is an extract of the detailed format of financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements)

Regulations, 2015. The full format of the financial results is available on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com) and the Bank's website (www.icicibank.com).

a total consideration of ₹ 3,092,93 crore. The sale resulted in net gain (after sale related expenses) of ₹ 3,036.29 crore in standalone financial results and ₹ 2,715.87 crore in consolidated

For and on behalf of the Board of Directors

Anup Bagchi Executive Director DIN-00105962



A Kirloskar Group Company Registered Office: Hadapsar Industrial Estate, Pune - 411013 CIN: L29120PN1974PLC110307



## 45" Annual General Meeting to be held over VC/OAVM

The Members of the Company are hereby informed that the 45th Annual General Meeting (AGM) of the Company will be held over Video Conference (VC) / Other Audio Visual means (OAVM) on Friday, August 21, 2020 at 11.30 am (IST) in compliance with the provisions of the Companies Act 2013 ("the Act") and rules thereof, including amendments thereunder read with the General Circular No. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020 and 20/2020 dated May 5, 2020 issued by the Ministry of Corporate Affairs (MCA Circulars) along with the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, including amendments thereunder read with the SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, to transact the business that shall be set forth in the Notice of AGM.

In terms of the above MCA Circulars and SEBI Circular, the Company shall send the AGM Notice and the Annual Report for the year 2019-20 including the Financial Statements for the year ended March 31, 2020 vide e-mail to those Members, whose e-mail addresses are registered with the Company / Registrar and Share Transfer Agent ("RTA") / Depository Participant(s). No physical copies of the Annual Report including Notice of the AGM will be sent to any Member of the Company. Members can join and participate in the 45th AGM. A Member attending the AGM through VC / OAVM shall be counted for the purpose of reckoning the guorum under provisions of Section 103 of the Companies Act, 2013. The instructions for joining 45th AGM and manner of participation in the remote e-voting / e-voting

during the AGM shall be provided in the notice of 45th AGM. The Company has engaged the services of National Securities Depository Limited (NSDL) to provide e-voting facility to members of the Company which would enable them to cast votes electronically. The Notice of the 45th AGM & the Annual Report for the year 2019-20 will also be made available on the Company's website www.kirloskarpneumatic.com, stock exchange website www.bseindia.com and on NSDL website at www.evoting.nsdl.com.

In view of the above, Members are requested to register at the earliest their email addresses or changes therein, if any, to receive the Annual Report including the AGM Notice electronically and to receive login ID and password for e-voting as per details given below.

 Registration of Email Id for shareholders holding physical shares: The Members of the Company holding Equity Shares in physical form and who have not

registered their e-mail addresses may get their e-mail address registered with the Company's RTA, Link Intime India Pvt Ltd, by clicking the link: https://linkintime.co.in/emailreg/ email register.html or through their web site www.linkintime.co.in > Investor Services > E mail / Bank Registration > select 'KIRLOSKAR PNEUMATIC COMPANY LIMITED' and follow the registration process as guided therein. The members are requested to provide details such as Name, Folio Number, Certificate number, PAN, Mobile number and Email ID and also upload the image of share certificate in PDF or JPEG format (up to 1 MB) and other supporting. On submission of the shareholder's details, an OTP will be received by the shareholder, which

needs to be entered in the link for verification. Post successful registration of email, the shareholder would be provided soft copy of the notice and the Annual Report and the procedure for e-voting along with the User ID and the Password to enable e-voting for the AGM. In case of any query, Shareholder may write to pune@linkintime.co.in.

2. Registration for Demat shareholders:

Members are requested to register their e-mail address, with their respective Depository Participant (DP) by following the procedure prescribed by them.

Further the Members holding shares in physical form and who have not updated their bank account details for receiving the dividend, if any, directly in their bank accounts through electronic mode or National Electronic Clearing Service (NECS), may visit the link https://linkintime.co.in/emailreg/email register.html > select the Company Name - Kirloskar Pneumatic Company Limited and follow the registration process as guided there in detail. Likewise, for shareholders holding shares in Demat should approach their respective Depository Participants and follow their prescribed procedure to register their bank details.

> By the Order of the Board of Directors For KIRLOSKAR PNEUMATIC COMPANY LIMITED

> > Jitendra Shah

Company Secretary

Place : Pune Date : 25 July 2020

 Tel.No.: +91 20 26727000 • Fax: +91 20 26870297 E-mail : sec@kpcl.net • Website : www.kirloskarpneumatic.com

"Mark bearing word 'Kirloskar' in any form as a suffix or prefix is owned by Kirloskar Proprietary Ltd. And Kirloskar Pneumatic Company Ltd. is the Permitted User"

financiale

July 25, 2020

Mumbai

30, 2020 and other agenda items, if any.

The said information is also available on the website

For Maan Aluminium Limited

ZENOTECH LABORATORIES LIMITED

Anu Aggarwal Company Secretary

Year ended

**Audited** 

2,719.08

440.79

636.96

1,077.75

1,073.07

6,103.06

(1,140.16)

1.77

Pursuant to Section 91 of the Companies Act, 2013 (the Act) read with Companie

The Company will provide the facility to its Members to exercise their right to vote by

For UFO Moviez India Limited

# આણંદમાં આજે કોરોનાના ૧૩ નવા કેસ નોંધાયા : કુલ આંક ૪૫૬ પર પહોંચ્યો

જિલ્લામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, ત્યારે સ્થાનિક નાગરિકોમાં પણ ચિતાનો માહોલ બન્યો છે. શનિવારે કોરોનાના ૧૩ પોઝિટિવ દર્દીઓ સામે આવતા જિલ્લામાં કલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૪૫૮ સુધી પહોંચ્યો

જેમાં આવાંદ અને પેટલાદ તાલુકામાં કુલ ચાર કેસ નવા સામે આવ્યા છે. પેટલાદમાં નવા કોરોના પોઝિટિવ કેસ નો ધાયાપેટલાદમાં નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઆગ્રંદ તાલુકામાં જે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેમાં તુલસી આંગનમાં રહેતા હિનાબેન પટેલ આવંદ તાલુકાના લાલપુરા ગામે રહેતા સરોજબેન પાઉ

ગામડીમાં રામજી મંદિરની ખડકીમાં રહેતા ગીતાલેન પટેલ અને બાકરોલમાં રહેતા કૈલાકબેન પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખંભાત શહેરના બિલપાડ વિસ્તારમાં રહેતા પ્રભાબેન રાજા. સોજીત્રાના રાભાયોક વિસ્તારમાં કેવાસબેન રાલા, દેવીનીયોળમાં રહેતા રક્ષાબેન કોરોના પોઝિટિવ છે. જ્યારે બોરસદના બ્રાહ્મણવાડામાં રહેતા મહેન્દ્ર પંચાય અને દિપક સિંહ ઉર્ફે સમૂભા જડવનો સમાવેશ થાય છે. આવંદમાં આજે કોરોનાના ૧૩ નવા કેસ નોંધાયા, કુલ આંક ૪૫૬ પહોંચ્યોપેટલાદની સચિન સોસાયટીમાં રહેતા અંજનાબેન

પટેલ. મસ્લિમ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ વહોરા.

સીમરડા ગામે રહેતા યક્ષેશ કુમાર તથા નાર ગામના કાછીયાવાડમાં રહેતા કનુભાઈ કાછીયાનો રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો છે. આ તમામ દર્દીઓ પૈકી એક દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે છ દર્દીઓ ઓક્સિજન પર તેમજ ત્રણ દર્દીઓની હાલત અત્યારે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. ૧૦ પૈકી સાત દર્દીઓને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના ખાતે તથા બે દર્દીઓને એસએસજી વડોદરા ખાતે તથા એક દર્દીને આવાંદ જનરલ હોસ્પિટલમાં આઇમોલેટ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

### ભારત માટે સંચુકત રાષ્ટ્રનો ચિંતાજનક રિપોર્ટ

# આઈઆઈએસ આતંકીઓની હાજરી

આતંકવાદ અંગે સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ચેતવલી ઉચ્ચારવામાં આવી છે કે કેરળ અને ક્વાટિકમાં આ દઈએ સ આ દઈએ સના આતંકવાદીઓની ખૂબ 'મોટી સંખ્યા' હોઈ શકે છે. આ વાત પર પગ ધ્યાન આપવામાં આવે કે ભારતીય ઉપખંડમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા હુમાલાનું પડયંત્ર ઘડી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યામારના ૧૫૦થી આતંકી સામેલ 300 છે.આઈએસઆઈએસ. અલ-કાયદા અને સંબંધીત વ્યક્તિઓ અને સંસ્થા પરના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઉપખંડમાં અલ

તાલિબાન અધ્યાનિસ્તાનના નિમરૂઝ, હેલમંદ અને કંધાર પ્રાંતથી કામ કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સમાચાર પ્રમાણે સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના ૧૫૦ થી ૨૦૦ જેટલા રાભ્ય છે. એક્યુઆઈનો વર્તમાન વડો ઓસામાં મહસુદ છે. ઓસામાએ માર્યા ગયેલા આસિમ ઉપરની જગ્યા લીધી છે. સમાચાર પ્રમાણે અલ-ક્રયદા પોતાના પૂર્વ વડાના મોતનો બદલો લેવા માટે આ વેત્રમાં જવાબી કાર્યવાહી કરવાનું પડયંત્ર થકી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે એક સભ્ય રાષ્ટ્રએ સંચના આપી છે કે ૧૦ મે. ૨૦૧૯ના રોજ જાતેર કરાયેલા આઈએગઆઈએગના ભારતીય વિશાળાહ)માં ૧૮૦થી ૨૦૦ સભ્ય છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેરળ અને ક્વાટિક જેવા રાજ્યમાં ISISની સંખ્યા વધારે પ્રમાણમાં છે. ગત વર્ષે મે મહિનામાં, ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠને ભારતમાં નવો પ્રાંત સ્થાપિત કરવાનો દાવો કર્યો હતો. કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામલ બાદ આ અનોખી જ જાહેરાત હતી. ખુંખાર આતંકવાદી સંગઠને પોતાની રામાચાર એજન્સીના માધ્યમથી કહ્ય હતુ કે નવી શાખાનું અરબી નામ વિશાયાન ઓફ હિન્દ (ભારત પ્રાંત) છે. જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ દાવાને કગાવી દીધો હતો.

## ગુજરાતમાં પરિવર્તન : દિલ્હીમાં ચિંતન-अने नपा नामने सर्घ भाषाइट અમદાવાદ,તા.૨૫

ગુજરાત વિધાનસસભા ચૂંટશીમાં ભાજપે સત્તા મેળવવા માટે પરિવર્તન નહીં કે પુનરાવર્તેનનું અનોખુ સૂત્ર આપ્યું હતું અને થયું પણ એવું જ કે પરિવર્તન થયું અને કોંગ્રેસના સ્થાને ભાજપની સત્તા આવી. ત્યારથી ગાંધીનગરની ગાદી પર ભાજપના મુખ્યમંત્રીઓમાં નરેન્દ્રભાઇ મોદ્રી સિવાય કોઇએ સત્તાના પાંચ વર્ષ પરા કર્યા નથી, ના. નહીં જ. કેશુભાઇ, સુરેશ મહેતા, કરીથી કેશભાઇ, ussl નરેન્દ્રભાઇ(૧૩ વર્ષ રાજ કર્યું) પછી આનંદીબેન પટેલ (ફેસબુક પર રાજીનામાની જાહેરાત કરી હતી) તેમના પછી સકેદ વસ્ત્રધારી નીતિન પટેલના હાથમાંથી લાડુ લઇને વિજય રૂપાલીના મુખમાં મૂકાવો. ૨૦૧૭ પછી કરીથી રૂપાળી અને ૨૦૨૪માં વિષાનસભાની ચૂંટલીઓ રૂપાલીના નેતૃત્વમાં લડાશે તેની કોઇ ગેરેટી ભાજપમાં આપવા તૈયાર નથી. કેમ કે તેઓ પૈલા સૂત્રમાં માને છે-પરિવર્તન !સંગઠનમાં પરિવર્તન થયું અને સફેદવસ્ત્રધારી સુરતીલાલા, આમ તો મરાઠીભાઉ કહી શકાય એવા સીઆરપી-૧૦૦ને આગામી ચંટલીઓની જવાબદારી સોંપવામાં આવી. નખ વગરના વાધાલી ગયા. અને હવે સંગઠનની બેઠકોમાં સીઆરપીની સાથે સીએમ તરીકે કોલ पाछी अञ नेनी अट्रह्मा वर्णी થઇ છે સંગઠનની નવી જવાબદારી સંભાગ્યા બાદ સીઆર પાટિલ વ લામાન નવેન્ડભાઈની ઓપગાઉદ મલાકાત લેવા દિલ્હી પહોચ્યા હતા. ભાજપના સુત્રો કહે છે કે પાટિલ પીએમને મળ્યા બાદ સંગઠનમાં હાઇકમાન્ડને મળીને તેમજ્ઞે સંગઠનની સાથે સરકારમાં પણ પરિવર્તન માટે કેટલાક કેરફારોની યાદી મડી ત્યારે કહેવાય છે કે હાઇકમાન્ડે તેમને એમ કહ્યું હોવાનું મનાય છે કે કેટલાક મંત્રીઓ જ નહીં પણ સીએમ સહિત આખી સરકાર જ બદલવાની છે, એટલે યોભો અને રાહ જુઓ.બીજી તરફ સેકન્ડ નંબર જુથ એમ આગ્રહ રાખે છે કે રૂપાલીજીને

સચિન પાયલટની જે મહત્વાકાંશા રાખવામાં ખોટુ શું છે! આનંદીબેનના રાજીનામાં પછી હાથમાંથી લઇ લેવાયેલો સીએમરૂપી લાડવો કરીથી મળી

જ્ય કેમ કે આ ગુજરાતનું રાજકારજ્ઞ છે. ક્યારે શું બને કહેવાય નહીં. કોલે કલ્પના કરી હતી કે શંકરસિહભાપુ બળવો કરશે અને પોતાના ધારાસભ્યોને લઇને રાતોરાત વિમાનમાં ઉડી જશે.આ રિસોર્ટ પોલીટીક્સનો પાયો લાગે છે કે ૧૯૯૫માં ગુજરાતે જ નાંખ્યો છે! કોલે કલ્પના કરી નની કે વાલીઓ પોતાના છોકરાનું नाम श्रीयन राज्य અચકાતા હતા ત ચીમનભાઇ પટેલ ૧૭ વર્ષ બાદ ૧૯૯૦માં વટભેર કરીથી ગુજરાતના નાથ બનશે કોલ કલ્પના કરી હતી કે એમના જ સાથી નરતરિ અમીન ભાજપમાં જરો જવાહર ચાવડા, અલ્પેશ શકોર કુંવરજી બાવળિયા, ડો. આશાબેન પટેલ

ભાજપમાં જોડાશે

ચાલુ રાખીએ, કેટલાક મંત્રીઓના સ્થાને નવા ચહેરા લાવીએ, બાકીનું અમે સંભાળી લઇકું ! આમ એક જુથ નવી સીએમનો આગ્રહ રાખે છે તો બીજુ જુથ રૂપાલી બલે રહ્યાં, પાટિલ છે સંભાળી લેશે..એવો વિશ્વાસ આપે છે. પરંતુ સીએમ બદલવાની વાત કરનાર જુવને ખબર છે કે ૨૦૧૭માં ભાજપને રૂપાણીના ભરોસે માંડ માંડ ૯૯ બેઠકો કઈ રીતે મળી હતી. સુરતની તમામ ૧૮ બેઠકો ન મળી હોત તો ઉપાસી વિપક્ષના નેતાપદે બિરાજતા હોત એ પણ આ જુવ જાણે છે. તેથી તેઓ ૨૦૨૪માં ફરીથી ૯૯ નહીં પણ અગાઉની જેમ ૧૨૧, ૧૨૫ એટલી બેઠકો માટે પરિવર્તનનો આગ્રહ રાખી રહ્યાં છે.સૂત્રોના મતે પાટીદાર પરિબળમાં પાટિલની સાથે પોતાની સરખામણી કરનાર અન્ય સફેદ વસ્ત્રધારી નીતિન પટેલને આનંદીબેન પટેલની જેમ કહેવાય છે કે રાજ્યપાલની ઓફર કરવામાં આવી પરંતુ ૯૪ વર્ષની વચે તેઓ પોતાની રાજિક્ય પ્રસ્કોર્દી આયમવા દેવાને બદલે વળી નશીબ આડેથી પાંદડુ ખસે તો ગુજરાતના નાવ બનવાની તક મળે એવા સપનાઓ જોઇ રહ્યાં છે. અને એવા સપના જોવામાં કાંઇ ખોટુ નથી. આખરે તો પરિવર્તન ભાજપનો મંત્ર છે અને

> (भरेता आर्यलोक्ष इत्रोक्षे डेऑडट्स डंपली तरीडे कोमानाती इती) (श्रील १ नेपरावरणवर्णस्थार/पोत्रावीकारतक) क्का. क्लेब्रिक र सर्थे के. १९/८, ६९ १को वड, १४४ र स्ट्राइटकार ता. पीर्वक, ३१. पेकारात, गुण्यात Wheth: www.gf.co.ir. Ersal bydessiggt.co.ir નોટીસ

ગુજરાત ફ્લોરોકેમીકલ્સ લિમીટેક

લાવી દુવાના માત્રવામાં આવે છે કે કંપનીના મોર્ડ એક પ્રિડિક્ટરો નો બેઠક છા. **૩૦થી ગુલાઈ ૧૦૧૦ મુક્રવારે** આશે. જેમાં કેલીના કેમ્યુલિયત, ૧૯ અને ૧૯ કૃષ્ય (દીરદીંગ કોમ્પ્લીકેશમાં એન્ડ લીક્ક્લોક્ટ રિકા લાગેન્ટર) કેમ્યુલિયત, ૧૯૧૧ ની પોલમાર્થ પ્રમાણે ૩૧થી વર્ષ ૧૯૧૦ કરેલીટેટ તાંદાલીય પ્રદેશભો (ક્રાંતાનકીંચર ઈઝાટ) ત્યાં તા. ૩૦મી પુત્ર ૧૦૧૦ના દીપ પુત્ર વર્ષણ પર્ય મહે ત્રેમાંદીક અનામેદંદિ: નોલાકીંગ પહેરામાં (ક્રાઇનપસીધલ ઈઝાટ) દેવાને તેમ તેમજ મેપુત્ર કરવાની સાથે આકારીની મેપૂર્દરો कल होते भारत होन ते हाथ पर क्षेत्रामां नारती

रंगकेल क्ष्मन केवरीनी केवलाड www.gfl.co.in अने वीलेका www.bseindia.com www.nseindia.com vo violeti rii. ગુજરાત ફળોરોકેમીકલ્સ લિમીટિક વર્તી

m. sull your, sees

ता. १५वर्षे पुलाई २०१० पन्छाः नामः भग्नेदश

लापिन देशार्छ

### જ્યુંકએલ લિમીટેડ

દેશ મુખરાત કલોદો કેમીકલ કંપની તરીકે ઓળખાતી હતી) (સ્ત્રીન : એલવપગ૧-લ્કુલ્વેગ્સ્ટ્સપોએલસીન્ન્ટક્કવ) स्थाः, क्योंडीका : सर्प सं. १५/ ३, १४ असे २४, गाम : स्थापातमान : ३८०३८० सः. विकेशः, १६ पेक्स्यातः, गुप्तसा अभिनेतः : bucasi glicoin/bhasishab@glicoin

#### नोटीस

લા આપવામાં અપે છે કે કંપનીના એડી ઓફ દિવેક્ટર્સ ની વેક્ક **તા. કન્મી યુલાઈ, ૧**૦૨૦ मुक्रमदे भगने, पेमां रोजीन रेप्युरेशन का अने एक पुष्प (र्रावरींग मोन्सीनेशन्स मेन्ड डीव्डरोत सामिक्टल है जिल्लीका, २०१४ मी फोलावां प्रसाही **का. ३१ओ आर्थ १०१०मा** हें प्रमुत करेता प्रस्ति भोजीठ बांडाडीम परिकासे (इडाबन्डीबर टेंक्टर) स्थले डेमा तेरण संपुर इटमली साथै समक्षामीन क्षेत्रीची करण होता कारत होता है हता पर तेवाले करणते.

des gen évelel inacis semplimistations, en elektri sembolistation : नेवार सीतेपाला निरुप्त पीर्त पत्रे से को कोची बर्डेंड केंब्रायीन केंब्रायांट फेन्स्ट्रेंडर **इत्तर, १८८वेंटरी, १९४९** फ चोर्य कार्रे करे.

शबेडुबेल विभीरेड पती off. OHE THE

**<u><u>षंपनी</u>** शेक्टरी</u>

## ઠપકો આપવા બદલ ગુપ્તી બતાવી મારી નાંખવાની ધમકી આપી

ઠપકો આપવા બાબતે ઘરે ધર્સી આવેલા માયાભારે શખ્સોએગમ બતાવી અનધી માંરી નાખવાની ધમકી ઉચ્ચારી હતી. ફતેગંજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર છાણી જકાતનાકા એકતાનગરમાં રહેતા કિરિટભાઇ સોલંકી કિરીટભાઇ સોલંકીના મોટાભાઇ અશોકભાઇ સોલંકીઓ ભગીજા રજનીકાંતને લઇ જવા બદલ રવિ શર્માને ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી રાત્રિના સમયે રવિ શમાં તેના અન્ય બે સાગરીતો અન્ય ભાવસાર તથા સંજય સપકાલ સાથે અશોકભાઇ સોલંકીના ઘરે ધર્સી આવ્યો હતો. અશોકભાઇ સોલંકીને બહાર બોલાવ્યા બાદ તારે શું હતું તેમ રવિએ કહેતા તુ તુ મે મે યઇ હતી. માચાભારે ત્રિપુટીએ બિભાસ ગાળો ભાંડી હતી ત્યાર પછી રવિ શમાંએ ગુમી બતાવી અશોકભાઇ સોલંકીને બનથી મારી નાખવાની યમકી ઉચ્ચારી હતી.

### ફેનેજની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે अहरभातना બનાવો

વડોદરા, તા. ૨૫ શહેરના શાસ્ત્રીબ્રિજના વળાંક પર પડેલા મસમોટા ખાડા અને છેલા બે વર્ષતી ચાલતી ડ્રેનેજની કામગીરીના કારણે રોજ અંદાજે દશ જેટલા અકસ્માતો થાય છે તથા વાહનોને નકશાન થઇ રહ્યું છે.

નવાયાર્ડ શાસ્ત્રી બ્રિજની બાજુમા જવાના રસ્તે છેજ્ઞા બે વર્ષથી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે.ગોરવાથી આવતા ધસમસતા ટ્રાફિક અને પોલીટેકનીકના ગેટને અડીને ચાલતી

ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઇ રહી નથી. પાલિકા ડ્રેનેજ કે રસ્તાઓને મજબત કરવાની વાતો તો દુર રહી ખાડાઓ પુરવામાં પણગંભીર બેદરકારી દાખવી

આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે કમિસ્તર સમક્ષ રજૂઆતો કરતા જણાવ્યુ હતુ કે, અહી થતા અકસ્માત ગંભીર બાબત છે વાહનોને યતાં નુકશાન માટે પાલિકા જવાબદાર છે તાત્કાલીક અહીં જરૂરી કાર્યવાહી કરાવવા તેમણે જણાવ્યું હતું.

## રાજપીપળામાં કોરોનાના કેસ વધતા સમસ્ત વૈષ્ણવ વર્ણિક સમાજ દ્વારા ઉકાળાનું વિતરણ

(પ્રતિનિધિ)રાજપીપલા,તા.૨૫ નર્મદા જિજ્ઞામાં કોરોનાની કહેર <u>દુનજ વધી ગયો છે ગુરુવારે ૪૦ થેટલા</u> કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જેમાં રાજપીપળા શહેર માં સૌથી વધ કેસ દ્યોવા મળ્યા હતા તે ચિંતાજનક બાબ્યત કહેવાય ત્યારે લોકડાઉન કરમ્યાન સારી સેવા કરનાર રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વસિક સમાજ દ્વારા ઠાલ ની સ્થિતિ જોતા કરી એક વાર શુક્રવાર થી ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે.નમંદા જિલ્લા પંચાયત આવેલીંદેક વિભાગ ના વડા ડો.નેહા પરમાર અને ટીમ દ્વારા આયુષ મંત્ર<u>ાલય ની ગાઇડ</u>

લાઇન મુજબ શરીરમા રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા ને બનાવવા માટે સમસ્ત वैभ्यव विश्व સ મા જ રાજપીપળાના પ્રમુખ તેજરાભાઈ ગાંધી. ઉરેશભાઈ પરીખ ગુંજનભાઈ મલાવીયા, કેપુર ગાંધી, કીશલ કાપડિયા, જયદીપ પાઠક, બિનીત શાહ શૈલેષ પારેખ સહિત નાઓ એ વહેલી સવારે ચાર વાગ્યાથી

# દર્શન કરાવ્યા છે.

ઉકાળો બનાવવાનું શરુ કરી રાજપીપળામાં જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે તેવા કન્ટેનમેન્ટ વિસ્તારો ગણાતા કાઈીયાવાડ,સોનીવાડ, કસ્બાવાડ, માછીવાડ, સ્ટેશન બેક રોડ,પારેખ ખડકી, સિંધીવાડ, માલિવાડ જેવા વિસ્તારમાં ઉડાળો ઘરે ઘરે જઈ ને વિતરણ કર્યો હતો.ત્યારે આરોગ્ય વિભાગ સાથે વારંવાર ખંડે પગે રહી આવા સેવાકાર્યના કામ કરતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, રાજપીપળાના હોંદેઘરો અને સભ્યો એ ફરી માનવતાના

#### સાવલી તાલુકાના મોકસી ગામે બે દિવસ અગાઉ મળેલી

# બાળકીની તપાસ કરતા સગીર બાળકી તેની માતા હોવાનું અને પ્રેમપ્રકરણ હોવાનું બહાર આવ્યું

(પ્રતિનિધિ) સાવલી, તા. ૨૫ સાવલી તાલુકાના મોકસી ગામે બે દિવસ અગાઉ જન્મેલી બાળકીને ગામના એક ઘરના ઓટલા પર પાસે ત્યજી દેવામાં આવેલ હતું આ બાબતે પોલીસને જાણ થતાં તેનો કબજો મેળવી વડોદરા સચાજી દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવી હતી જ્યાં તે બાળકીની સારવાર દરમિયાન

મોત નીપજ્યું હતું ભાદરવા પોલીસે પ્રાથમિક બાળકીને બાનથી મારી નાખવાના પ્રયાસના ગુના હેઠળ અજ્ઞણ્યા વ્યક્તિ સામે ગનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન પોલીસે ગામમાં પૂછપરછ શરૂ કરતાં જે મકાનના ઓટલા પાસેથી બાળકી મળી આવી હતી તે જ મકાનમાં રહેતી ૧૫ થી ૧૬ વર્ષની સગીર છોકરી ગાયક જણાઈ હતી જેની પોલીસે શોધખોળ કરીને પૂછપરછ

અને તેને પોતાની આપવીની પોલીસને જણાવી હતી જેમાં બહાર આવ્યું હતું કે સાતેક માસ અગાઉ આ છોકરી ગામના બીબ્ર કળિયામાં તેના માતા-પિતા સાથે રહેતી હતી હવાં તે ફળિયા માં રહેતો એક છોકરો સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતોઅને છોકરા એ તે છોકરીને લગ્ન કરવાના વચનો અને લાલચ આપીને છોકરી સાથે સંભોગ કર્યો હતો સમય જતાં ત્રણ ચાર માસ બાદ છોકરી ને માસિક ન આવતા તે છોકરીએ છોકરાને વાત કરી હતી જ્યારે છોકરાએ છોકરી ને એવું આશ્વાસન આપ્યું હતું કે આપશે લગ્ન કરવાના છીએ તો તું સગભાં હોય તો પણ કંઈ વાંધો નહીં આવે આપને આવનાર બાળકને અપનાવી શું તેવામાં છોકરી અને તેના માતા-પિતા આ જ ગામના અન્ય ફળિયામાં રહેવા જતા રહ્યા હતા સાત એક મહિનાનો સમય વીતી જતા

છોકરાને ફરીથી વાતચીત કરતા છોકરા એ વિચાર બદલ્યો હતો અને છોકરી ને ગર્ભપાત કરવાની ગોળીઓ ખવડાવતા છોકરીએ સાત માસની બાળકી સમય પહેલા જન્મ આપ્યો હતો આવી પરિસિયતિ તે ગભરાઈ જઈને છોકરીએ પોતાના ઘરના ઓટલા પર જ નવજાત બાળકીને ત્યજી દીધી હતી. પોલીસ તપાસ દરમિયાન વિગતો બહાર આવતા પોલીસે તે છોકરા સામે પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની વધુ પૂછપરછ કરતાં તેણે આ કૃત્ય કરી હોવાની કબ્લાત કરી હતી લ્યારે તેના માતા-પિતાએ આ છોકરો સગીર હોવાનો દાવો કરતા પોલીસે તે છોકરો સગીર છે કે નહીં તે બાબતે તપાસ કરવા તેમજ તેના ઉંગરના પુરાવા મેળવવા પ્રયત્નો હાથ પર્યા છે તેમજ તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પણ કાર્ચવાહી હાથ ધરી છે

#### ગુજરાત સરકારના બજાર ધારા સુધારા ૨૦૨૦ના વિરોધમાં

# એમસીના કર્મચારીઓએ કાળી

(પ્રતિનિધિ)પાવીજેતપૂર,તા.૨૫ આ બજારધારાનો ૩ દિવસ કાળીપડ્ડી ગજુરાત સરકાર દ્વારા બહાર ધારા ૨૦૨૦ વર્ક્કુકમ દ્વારા અમલી બનાવ્યા છે. જેનો આંશિક આવકારીને બાકીનો વિરોધ કાળી પટ્ટી બાંધીને કામગીરી કરીને નોંધાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા એપીએમસીના બબારધારાના ૨૬ જેટલા સુધારા વટહુકમ દ્વારા અમલી બનાવ્યા છે. જેને ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘના સભ્યો દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગસપે પાવી જેતપુર એપીએમસીના કર્મચારીઓએ પણ બાંધીને કામ કરીને વિરોધ કરવાનું ચાલુ કર્યું છે. ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા એક કાર્યક્રમની રુપરેખા થકી કાઢવામાં આવી છે. અને સરકાર તેના પર ધ્યાન નહિ આપે તો 3 દિવસ કાળીપત્રી ધારણ કરીને કામ કર્યા બાદ એક દિવસ માટે પેન ડાઉન. ત્યારબાદ એપીએમસીના યોગાનમાં એક દિવસ પ્રતીક ઉપવાસ, જસ્લ જણાય તો એક દિવસ બહાર બંધનું એલાન, તેમ છતાંય સરકાર વાત ન માને તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બે દિવસના પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે.

આ વિરોધ કાર્યક્રમમાં ગુજરાતની ૨૨૪ બલાર સમિતિઓના ૩૯૮૮ કર્મચારીઓએ સામહિક ભાગ લઈને વિરોધ નોંધાવી રહ્યા છે.

#### સમગ્ર શહેરમાં ૧,૦૩૬ જગ્યાઓએ કરવામાં આવેલ ડિસઈન્ફેક્ટની કામગીરી

વડોદરા,તા.૨૫ વડોદરા મહાનગર પાલિકાની અખબારી યાદીમાં જસાવવામાં આવે છે કે,વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોરના ૧૯૬ વાહનો અને ૧૧૧ ઓપન સ્પોટ વ્હિકલ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી હતી.

#### **PUBLIC NOTICE** CICICI Bank

ICICI Bank Limited CINLES1903.1994PL.CI21012 Tower, Near Chald Circle, Old Padra Road, Vadodara - 390.007. Iowers, Bandra-Kurla Complex, Bandra (East), Mumbei - 400.051 IO. Fax: 022-26531230, Email: investorg/ciciobana.com

FINANCIAL RESULTS

(₹ in crore) CONSOLIDATED

		STANDALONE			CONSOLIDATED		
Sr. no.		Three months ended		Year ended	Three months ended		Year ended
	Particulars	June 30, 2020 (Q1-2021)	June 30, 2019 (Q1-2020)	March 31, 2020 (FY2020)	June 30, 2020 (Q1-2021)	June 30, 2019 (Q1-2020)	March 31, 2020 (FY2020)
		(Unaudited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Unaudited)	(Audited)
1.	Total income from operations (net)	26,066.95	21,405.50	91,246.94	37,939.32	33,868.89	149,786.1
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	3,182.50	2,792.73	14,048.04	4,587.30	4,208.35	18,588.6
3,	Exceptional items	-					
4.	Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	3,182.50	2,792.73	14,048.04	4,587.30	4,208.35	18,588.6
5.	Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) (refer- note no. 2)	2,599.15	1,908.03	7,930.81	3,117.68	2,513.69	9,566.3
6,	Total comprehensive income for the period [Comprising profit/floss) for the period (after tax) and other comprehensive income (after tax)]		N.A.	N.A.	N.A.	N.A.	N.A
7.	Paid-up equity share capital (face value		4 200 20	4.004.00		4 000 00	
-	₹ 2 each)	1,295.41	1,290.73	1,294.76	1,295.41	1,290.73	1,294.7
8,	Reserves excluding revaluation reserves	114,205.75	106,059.73	112,091.28	121,705.39	112,386.99	118,518.4
9,	Earnings per share (EPS):						
	Basic EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹)	4.01	2.96	12.28	4.82	3.90	14.81
	Diluted EPS before and after extraordinary items, net of tax expense (not annualised) (in ₹)	3.98	2.91	12.08	4.76	3.83	14.55

Notice:

1. Since the first quarter of CY2020, the Covid-19 pandemic has impacted most of the countries, including India. This resulted in countries announcing tackdown and quartertine measures sharply stated economic activity. The Government of India initiated a nation-wide tockdown from March 25, 2020 which was further extended until May 31, 2020. Agradual and call

With an intention to mitigate the outries of debt servicing brought about by descriptions on account off Covid-19 pandemic and to ensure the continuity of valete businesses. RBI through circular dated March 27, 2029 parmitted bearies to grant a morabolism to their customers on the payment of netaliaments and/or interest, failing due between Matson't, 2029 on May 31, 32. This period was extended by RBI III August 31, 2020 through its circular dated May 23, 2020. The Bank has accordingly extended the morabolism option to its borrowers in accordance its Board approved poticios.

The impact of Covid-19 pandemic on the Bank is highly uncertain and will depend on the ongoing spread of Covid-19, the effectiveness of current and future steps taken by governments, certain banks to mitigate the economic impact, steps taken by the Bank and the limit takes for economic activities to return to pre-pandemic levels. The Bank is depicted and figurity post to strong and would curriture to be the focus area for the Bank during this period.

as enong and would construe to be the focus area for the Bank claring this period.

During Q1-2021, the Bank has made an additional Covid-19 related provision amounting to ₹ 5.550.00 crore. At June 30, 2020, the Bank has made an additional Covid-19 related provision of ₹ 8.275.00 crore. This additional provision made by the Bank is more than requirement as per the RBI guideline dated April 17, 2023.

2. During Q1-2021, the Bank is tidd equity shares representing 3.96% in ICXCI Lombard General insurance Company Limited and 1.50% in ICXCI Prodestial Life insurance Company Limited to a total constant entries of 2.302.93 or one. The sale resulted in ned gain (after sale related expenses) of ₹ 3.036.29 crore in standarde results and ₹ 2.715.87 crore in consolidated financial results and ₹ 2.715.87 crore in consolidated financial results are consolidated from the Bank has been sale from the sale results and ₹ 2.715.87 crore in consolidated financial results are consolidated from the sale results are consolidated from the s

Anup Bagchi Executive Directo DIN-00105962

Mumbal July 25, 2020

00 00 00 00 E